



ROLEX RINGS LIMITED

[CIN: L28910GJ2003PLC041991]

Regd. Office:-BEHIND GLOWTECH PRIVATE LIMITED, GONDAL ROAD, KOTHARIA, RAJKOT

Phone: (281)6699577/ 6699677

Email: compliance@rolexrings.com website. www.rolexrings.com

Ref: RolexRings/Reg. 47/Newspaper Publication

09th November, 2023

To,
Corporate Relationship Department,
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers, Dalal Street,
Mumbai-400001

To
National Stock Exchange of India Limited
Exchange Plaza, C-1, Block G
Bandra Kurla Complex
Bandra (E), Mumbai - 400 051

Script Code: 543325

Script Symbol: ROLEXRINGS

Sub: Intimation of Newspaper Publication pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure) Regulations, 2015

Dear Sir,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, Please find enclosed copy of Newspaper Publication of Standalone Unaudited Financial Results for the quarter ended 30th September, 2023 duly approved in the Board Meeting held on Tuesday, 07th November, 2023, in Financial Express (English) and Financial Express (Gujarati).

You are kindly requested to take the same on records.

Thanking You,

Yours faithfully,
For **Rolex Rings Limited**

(Hardik Dhimantbhai Gandhi)
Company Secretary & Compliance Officer
[Membership No. A39931]

GALLOPS ENTERPRISE LIMITED CIN : L65910GJ1994PLC023470
 Regd. Office : 9th Floor, Astron Tech Park, Near Satellite Police Station, Satellite, Ahmedabad - 380015
 T : +917926861459 / 60 || Website: www.gallopsenterprise.com || Email : investors.gallops@gmail.com
EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30TH SEPTEMBER, 2023 (Figures in Rs.)

Sr. No.	Particulars	Quarter Ended on		Year Ended on (Audited)
		30-09-2023 (Unaudited)	30-09-2022 (Unaudited)	
1	Total Income from Operations (Net)	-	-	6,946
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items#)	(3,96,894)	4,78,008	(4,17,340)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items#)	(3,96,894)	4,78,008	(4,17,340)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items#)	(3,96,894)	4,78,008	(4,17,340)
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(3,96,894)	4,78,008	(4,17,340)
6	Equity Share Capital	5,01,14,000	5,01,14,000	5,01,14,000
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	(3,52,18,846)
8	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations)	1) Basic : 2) Diluted :	0.10 0.10	(0.08) (0.08)

Notes : (1) The above is an extract of the detailed format of Quarterly / Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Annual Financial Results are available on the websites of the Stock Exchange www.bseindia.com and on the company's website www.gallopsenterprise.com (2) The Financial results were reviewed by the Audit Committee and taken on record by the Board of Directors at its meeting held on 06th November, 2023. (3) The information relating to Exceptional and / or extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules applicable to the company.
 Place : Ahmedabad For, Gallops Enterprise Limited
 Date : 06th November, 2023 **Balram Padhiyar**, Managing Director - DIN : 01812132

Regional Office, Lal Darwaja, Ahmedabad - 380001.

APPENDIX-IV [Rule-8(1)] POSSESSION NOTICE (For immovable property)

Whereas The undersigned being the authorized officer of the Central Bank of India, Unjha Branch, Dist Mehsana under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 18/07/2023 calling upon the borrower **Mrs. Pinalben Viralbhai Patel (Borrower), Mr. Viralbhai Ramjibhai Patel (Co-Borrower) Mr. Mitinkumar Gandadal Patel (Guarantor)** to repay the amount mentioned in the notice being **Rs. 8,80,800.63/- (In Words Rs. Eight Lakh eighty thousand eight hundred and paise sixty three Only)** plus interest from date as mentioned in notice, within 60 days from the date of receipt of the said Notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of Act read with rule 8 of the security interest Enforcement Rules 2002 on this **06.11.2023 i.e 06th Nov 2023.**

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Central Bank of India for an amount **Rs. 8,80,800.63/- (In Words Rs. Eight Lakh eighty thousand eight hundred and paise sixty three Only)** and interest thereon plus other charges. (Amount deposited after issuing of Demand Notice U/Section 13(2) has been given effect)

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Equitable Mortgage of Property in the Name of Mrs. Pinalben Viralbhai Patel and Mr. Viralbhai Ramjibhai Patel House No. 31 Somaiya Villa Bungalow Unjha Patan Highway Road Unjha , Tal. Unjha, District : Mehsana - 384170. R.S. No.1101 TP Scheme No 4 Fa Plot No 13, Bungalow No 31, Admeasuring Total 83.61 Sq.mtrs. East : Margin Land Of Said Plot FA Plot No 16, West : 6.00 Mtr Wide Internal Road, North : Margin Land of Said Plot No.32, South : Plot No 30.
 Date : 06/11/2023 Authorised Officer
 Place: Unjha Central Bank of India, Ahmedabad

Bank of Maharashtra
 Morbi Branch(1796), Meet Plaza, Savsar Plot, Street No 3/16, Off Sanala Road Morbi-363641
 TELE : 02822-222058 e-mail : bom1796@mahabank.co.in
 Head Office: Lokmangal,1501, Shivajinagar, Pune-5

APPENDIX-IV [See Rule 8(1)] PHYSICAL POSSESSION NOTICE (For immovable property)

Whereas The undersigned being the Authorized Officer of the Bank of Maharashtra under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notices dated **21.10.2022** calling upon the **M/s. Silversun Sanitaryware LLP (Borrower) & its Partners : Mr. Kaliasbhaji Dayalaji Merja, Mr. Nitinbhai Vashrambhai Shanghani, Mr. Ashokbhai Dayabhai Merja, Mr. Ravi Hareeshbhai Kaila, Mr. Divyesh Harjivanbhai Kaila, Mr. Darshan Rameshbhai Kaila, Mr. Chhaganbhai Makasana, Mr. Devraj Chhaganbhai Makasana, Mr. Satishbhai Prabhubhai Detroja, Mr. Avcharbhai Savjibhai Makasana, Mr. Rajeshbhai Mansukhbhai Sherasiya, Mr. Yuvraj Dineshbhai Bavarva, Mr. Brajesh Kamleshbhai Raval, Mrs. Lataben Kailashbhai Raval, Ms. Tejasvi Kailashbhai Merja, Ms. Nishita Kailashbhai Merja, Mrs. Prafulaben Darshankumar Kaila, Mrs. Rekhaben Devrajbhai Makasana, Mrs. Pritiben Prakashbhai Hulani** to repay the amount mentioned in the notice being aggregate amount of **Rs. 2,88,95,728/- (Rupees Two Crores Eighty Eight Lakh Ninety Five Thousand Seven Hundred Twenty Eight Only)** with further interest thereon as mentioned in the notice (less recovery made after issuance of the said demand notice), within 60 days from the date of receipt of the said notice.

The borrower/ Guarantor/ secured debtor having failed to repay the amount, the undersigned took **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement Rules 2002 and in compliance of Hon'ble Additional Chief Judicial Magistrate, Morbi Order dated- **11.10.2023** under Section 14 of the Said Act on this **05th day of November of the year 2023.**

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Maharashtra for an aggregate amount of **Rs. 2,88,95,728/- (Rupees Two Crores Eighty Eight Lakh Ninety Five Thousand Seven Hundred Twenty Eight Only)** with further interest thereon as mentioned in the notice (less recovery made after issuance of the said demand notice).

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act in respect of time available to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Registered Mortgage of property i.e. property bearing factory shed being land area 6446 Sq.mtrs. Total covered area 5794 Sq.mtrs. in S. No. 88P.1P.1 situated at Village Rapar, Ta. Morbi, Dist. Morbi owned by **M/s. Silversun Sanitaryware LLP** and same is bounded as under : **On or towards North by : Ad-joining agricultural land of S. No. 89, On or towards South by : Maliya (M) – Halvad Road, On or towards East by : Ad-joining agricultural land of S. No. 85, On or towards West by : Ad-joining agricultural land of S. No. 90.**

Mr. Deepak Kumar Gupta
 Chief Manager & Authorised Officer
 Bank of Maharashtra
 Date: 05/11/2023
 Place: Morbi

POSESSION NOTICE (for immovable property)

Whereas, The Authorized Officer of **INDIABULLS HOUSING FINANCE LIMITED ("IHFL")** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notice dated **23.11.2021** calling upon the Borrowers **BELIEVE GRAPHICS THROUGH ITS PROPRIETOR YOGESHCHANDRA PANKAJBHAI MISTRY AND DARSHANA YOGESHCHANDRA MISTRY** to repay the amount mentioned in the Notice being **Rs. 18,22,810.52 (Rupees Eighteen Lakhs Twenty Two Thousand Eight Hundred Ten and Paise Fifty Two Only)** against Loan Account No. **B0160XXIII (Earlier Loan Account no. HLPBAR00429563 of IHFL)** as on **20.11.2021** and interest thereon within 60 days from the date of receipt of the said Notice. Earlier the **IHFL** has assigned all its rights, title and interest of the above loan account in favor of **Indiabulls Asset Reconstruction Company Ltd. as Trustee of Indiabulls ARC-XXIII, Trust** by way of an Assignment Agreement dated **31.12.2021**. Further the **Indiabulls Asset Reconstruction Company Ltd. as Trustee of Indiabulls ARC-XXIII, Trust** has assigned all its rights, title and interest of the above loan account in favor of **Assets Care & Reconstruction Enterprise Ltd. ("ACRE")** by way of an Assignment Agreement dated **29.06.2022** and Loan Account which has been renumbered as Loan Account No. **B0160XXIII** in books of **ACRE**.

The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on **05.11.2023.**

The Borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Assets Care & Reconstruction Enterprise Ltd.** for an amount of **Rs. 18,22,810.52 (Rupees Eighteen Lakhs Twenty Two Thousand Eight Hundred Ten and Paise Fifty Two Only)** as on **20.11.2021** and interest thereon.

The Borrower's attention is invited to provisions of Sub-Section (8) of Section 13 of the Act in respect of time available, to redeem the Secured Assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY (IES)

SHOP NO. 57, VIMLANATH COMPLEX, HIGHTENSION ROAD, VADODARA, GUJARAT - 390020.

Sd/-
 Authorised Officer
 Assets Care & Reconstruction Enterprise Ltd.
 (102-TRUST)
 Date : 05.11.2023
 Place: VADODARA

यूनियन बैंक ऑफ इंडिया
Union Bank of India
 A Government of India Undertaking

Union Bank of India - Junagadh Branch (26271) : Jayshree Talkies Road, Kitecha Commercial Complex, Junagadh - 362 001. Email- ubin0826278@unionbankofindia.bank

[Rule 8 (1)] POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, The undersigned being the authorized officer of **Union Bank of India, Jai shree Talkies Road, Branch Junagadh - 362001** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement Security Interest Act, 2002 (Act No. 54 of 2002)and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated - **08.10.2021** calling upon **Borrower/Guarantor M/s Bhavani Food Products Prop. Mr. Hirenkumar Ratilal Pansara (Borrower), Maganbhai Gordhanbhai Hirapara (Guarantor), Kishorkumar Mavjibhai Trada (Guarantor)** to repay the amount mentioned in the notice being **Rs. 61,81,450.45/- (Rupees Sixty - One Lakh Eighty One Thousand Four Hundred Fifty and Forty Five Paisa Only)** (as on 31.03.2021) + Interest and other charges thereon within 60 days from the date of receipt of the said notice.

The Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 8 of the said rules on this **06th day of November of year 2023.**

The Borrower/Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Union Bank of India** for an amount **Rs. 61,81,450.45/- (Rupees Sixty - One Lakh Eighty One Thousand Four Hundred Fifty and Forty Five Paisa Only)** (as on 31.03.2021) + Interest and other charges thereon.

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to the borrower to redeem the secured assets.

DESCRIPTION OF SECURED ASSET

All that Part and Parcel Land and Building being Commercial Godown constructed on land of Plot No. 21 and 24, Total Land Sq. Mtr. 219-60 of N.A. Land R. S. 450 paiki of Gondal, situated at Rajkot-Jetpur Road, National Highway Bypass Road, City : Gondal, Ta. : Gondal, Dist. : Rajkot in the name of **Mr. Kishorbhai Mavjibhai Trada** and Bounded as under :
Point Boundaries of Plot No. 21 and 24
 East : Plot No. 22 & 23 West : 7.50 Mt Road
 North : Plot No. 25 South : Plot No. 20
 Date : 06.11.2023, Authorised Officer
 Place : Gondal Union Bank of India

Bank of Maharashtra
 Morbi Branch(1796), Meet Plaza, Savsar Plot, Street No 3/16, Off Sanala Road Morbi-363641
 TELE : 02822-222058 e-mail : bom1796@mahabank.co.in
 Head Office: Lokmangal,1501, Shivajinagar, Pune-5

APPENDIX-IV [See Rule 8(1)] PHYSICAL POSSESSION NOTICE (For immovable property)

Whereas The undersigned being the Authorized Officer of the Bank of Maharashtra under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notices dated **21.10.2022** calling upon the **M/s. Silversun Sanitaryware LLP (Borrower) & its Partners : Mr. Kaliasbhaji Dayalaji Merja, Mr. Nitinbhai Vashrambhai Shanghani, Mr. Ashokbhai Dayabhai Merja, Mr. Ravi Hareeshbhai Kaila, Mr. Divyesh Harjivanbhai Kaila, Mr. Darshan Rameshbhai Kaila, Mr. Chhaganbhai Makasana, Mr. Devraj Chhaganbhai Makasana, Mr. Satishbhai Prabhubhai Detroja, Mr. Avcharbhai Savjibhai Makasana, Mr. Rajeshbhai Mansukhbhai Sherasiya, Mr. Yuvraj Dineshbhai Bavarva, Mr. Brajesh Kamleshbhai Raval, Mrs. Lataben Kailashbhai Raval, Ms. Tejasvi Kailashbhai Merja, Ms. Nishita Kailashbhai Merja, Mrs. Prafulaben Darshankumar Kaila, Mrs. Rekhaben Devrajbhai Makasana, Mrs. Pritiben Prakashbhai Hulani** to repay the amount mentioned in the notice being aggregate amount of **Rs. 2,88,95,728/- (Rupees Two Crores Eighty Eight Lakh Ninety Five Thousand Seven Hundred Twenty Eight Only)** with further interest thereon as mentioned in the notice (less recovery made after issuance of the said demand notice), within 60 days from the date of receipt of the said notice.

The borrower/ Guarantor/ secured debtor having failed to repay the amount, the undersigned took **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement Rules 2002 and in compliance of Hon'ble Additional Chief Judicial Magistrate, Morbi Order dated- **11.10.2023** under Section 14 of the Said Act on this **05th day of November of the year 2023.**

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Bank of Maharashtra** for an aggregate amount of **Rs. 2,88,95,728/- (Rupees Two Crores Eighty Eight Lakh Ninety Five Thousand Seven Hundred Twenty Eight Only)** with further interest thereon as mentioned in the notice (less recovery made after issuance of the said demand notice).

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act in respect of time available to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

Registered Mortgage of property i.e. property bearing factory shed being land area 6446 Sq.mtrs. Total covered area 5794 Sq.mtrs. in S. No. 88P.1P.1 situated at Village Rapar, Ta. Morbi, Dist. Morbi owned by **M/s. Silversun Sanitaryware LLP** and same is bounded as under : **On or towards North by : Ad-joining agricultural land of S. No. 89, On or towards South by : Maliya (M) – Halvad Road, On or towards East by : Ad-joining agricultural land of S. No. 85, On or towards West by : Ad-joining agricultural land of S. No. 90.**

Mr. Deepak Kumar Gupta
 Chief Manager & Authorised Officer
 Bank of Maharashtra
 Date: 05/11/2023
 Place: Morbi

ROLEX RINGS LIMITED
 Regd. Office : BEHIND GLOWTECH STEEL PRIVATE LIMITED, GONDAL ROAD, KOTHARIA, RAJKOT. Phone: 0281-6699577/6699677 [CIN: L28910GJ2003PLC041991]
 Email: compliance@rolexrings.com website. www.rolexrings.com

STATEMENT OF THE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2023
 [₹ in Millions except as stated otherwise]

Sr. No.	Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
		Sept.30, 2023	June 30, 2023	Sept.30, 2022	Sept.30, 2023	
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income from Operations	3245.95	3136.91	2928.54	6382.86	11982.54
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	632.78	650.26	605.03	1283.04	2432.66
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	632.78	650.26	605.03	1283.04	2432.66
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	469.63	484.37	491.79	954.00	1980.92
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	469.90	484.65	492.54	954.55	1982.03
6	Paid-up equity share capital (face value ₹ 10/- per share)	272.33	272.33	272.33	272.33	272.33
7	Other equity					7157.72
8	EPS [not annualized for quarters & Half years Figures]					
	Basic (₹)	17.24	17.79	18.06	35.03	36.31
	Diluted (₹)	17.24	17.79	18.06	35.03	36.31
	(see accompanying notes to the financial results)					

1 These unaudited financial results of the company for quarter and half-year ended September 30, 2023 have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on November 07, 2023. The financial results are prepared in accordance with the Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.

2 The company's business falls within single business segment of diversified auto components. Hence, disclosures under Ind AS 108- Operating Segments are not reported separately.

3 The above is the extract of the detailed format of financial results for the quarter and half year ended September 30, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The Full Format of financial results are available on the website of the Stock Exchanges(s) (https://www.nseindia.com, https://www.bseindia.com) and can be assessed at website of the Company at https://www.rolexrings.com

4 Previous period figures have been regrouped, rearranged and reclassified where necessary to conform to current period's classification.

Date : November 07, 2023
 Place : Rajkot
For Rolex Rings Limited
Sd/-
Manesh Madeka
 Chairman & Managing Director
 DIN: 01629788

indianexpress.com

I choose substance over sensation.

Inform your opinion with credible journalism.

The Indian Express. For the Indian Intelligent.

The Indian EXPRESS
 — JOURNALISM OF COURAGE —

Ahmedabad

